

ફિલેમોનાલ પાઉલ પ્રેષિતનો લોખલાં પત્ર પ્રસ્તાવના

ફિલેમોના પત્ર ખ્રિસ્તી લોકહા વચ્ચે સમાનતા એને સબંધાહા બારામાય દેખાડેહે, અનેસિમુસ (જ્યા મતલબ હેય “ઉપયોગી”) ઓ ફિલેમોન નાંવા ચોક વિસ્વાસી દાસ આતો, જો કોલોસી શેહેરામાય રોતો આતો. ઓહડા મેહસુસ ઓઅહે કા અનેસિમુસ ફિલેમોના ગોઆમાઅને ચોરી કોયન નાહાય ગીઅલો આતો, જોવે પાઉલાલ દોઇન કોલહોક સમયાહાટી જેલેમાય આતો, ચે સમયે અનેસિમુસા પાઉલા આરે મુલાકાત જાયી એને તો ખ્રિસ્તી બોની ગીઅલો આતો. ઓહડા લાગહે કા ઈ પત્ર એને કોલોસી પત્ર પાઉલે ચોક્યેજ સમય લોખલાં આતા, એને યાલ અનેસિમુસા આથેકોય ફિલેમોનાપાય લેય જાંહાટી દેનલા આતા (કોલોસી 4:9), પાઉલે ફિલેમોનાલ વિનાંતી કોઅયી કા તો અનેસિમુસાલ પોતાના ગોઅમે પાછો લેય જાય, બાકી ચોક દાસા હારકો નાંય બાકી પ્રભુમાંય ચોક બાહા હારકો, પાઉલા નોજરેમાય અનેસિમુસ કોલહોક વદારે “ઉપયોગી” આતો (વચન 11) આમી તો ચોક ખ્રિસ્તી આતો, ઓલે લોગુ કા પાઉલાય ફિલેમોનાલ ઓ બી વાયદો કોઅયો કા જી બી કમી અનેસિમુસા હેય, ચ્યા તો ભરપાઈ કોઅય દેઅરી.

પ્રસ્તાવના

1 આંય, પાઉલ ઈ પત્ર લોખી રિઅલો હેય. આંય ઈસુ ખ્રિસ્તા બારામાય પ્રયાર કોઅના લીદે કૈદી હેતાંવ, ઓ ફિલેમોન, આંય એને મા આર્યો તિમોથીયુસ તુલ સલામ આખજેહે, તું આમહે પ્રિય મિત્ર હેતો એને તું ખ્રિસ્તાહાટી તેહેકેજ કામ કોઅતોહો જેહેકેન આમા કોઅજેહે.

2 એને આંય આમહે વિસ્વાસી બોઅહી અફફિયા એને વિસ્વાસી બાહા અરખિખુસ, જો સૈનિકા હારકો પ્રભુવા સેવા કોઅહે એને મંડળીલબી જીં તો ગોઅમે બેગી ઓઅહે લોખતાહાવ.

3 આંય પ્રાર્થના કોઅહુ કા આપહે પોરમેહેર આબો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહાન સદા મોયા એને શાંતી દેય.

ધન્યવાદ એને પ્રાર્થના

4 આંય જોવેબી મા પ્રાર્થનાયે માય તુલ યાદ કોઅતાહાંવ, તે આપહે પોરમેહેરાલ સદા ધન્યવાદ દેતાહાવ.

5 કાહાકા આંય પ્રભુ ઈસુવોય તો બોરહા એને પોરમેહેરા બોદા લોકહાવોય તો પ્રેમ કોઅના બારામાય વોનાતાહાવ.

6 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા વિસ્વાસી લોકહાઆરે તો જીં સંગતી હેય તી તો ચ્યા બોદી હારી વસ્તુહુ જાઅનાથી, જીં પોરમેહેરાય આમહાન દેનલી હેય, વોદતા જાય. ઈ બોદા ખ્રિસ્તા મહિમાહાટી ઓએ.

7 ઓ બાહા, આંય તો બીજહાવોય પ્રેમ કોઅના બારામાય જાંઆઈન બોજ આનંદિત એને ઉત્સાહિત ઓઅય ગીયો, કાહાકા તોકોય પોરમેહેરા લોક ઉત્સાહિત ઓઅય ગીઅલા હેય.

ઉનેસિમુસાહાટી વિનાંતી

8 યાહાટી આંય તુલ ખ્રિસ્તામાય ચોક વિસ્વાસી રુપામાય યોગ્ય કામ કોઅરાહાટી આખતાહાવ, આંય ખ્રિસ્તા પ્રેષિતા રુપામાય ઈ ઈમાત કોઅય હોકહુ, એને તુલ ઈ કોઅરાહાટી આગના બી દેય હોકહુ.

9 બાકી આંય કેવળ તુલ આખી રિઅલો હેય, કાહાકા આંય જાંઅતાહાંવ કા તું માન એને તો આરી વિસ્વાસી બાહાહાવોય પ્રેમ કોઅતોહો, આંય પાઉલ, ચોક ડાયો માઅહુ વિનાંતી કોઅહુ જો ઈસુ ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના લીદે કૈદી હેય.

10 આંય ઉનેસિમુસાહાટી તુલ વિનાંતી કોઅહુ, જો મા પાહા હારકો હેય, જો મા આરે કૈદમાય મા આત્મિક પોહો બોની ગીઅલો હેય.

11 યા પેલ્લા તે તોહાટી કામા નાંય આતો, બાકી આમી તો એને મા બેનહયા બોજ કામા હેય.

12 આંય ઉનેસિમુસાલ બોજ પ્રેમ કોઅતાહાંવ, તેરુંબી આંય તોપાય પાછો દોવાડી રિઅલો હેય.

13 આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે કૈદમાય હેતાંવ તોવે, મા મોદાત્ કોઅરાહાટી તો જાગાવોય ચ્યાલ આંય મા આરે આનંદથી રાખી હોકતો.

14 બાકી તો પરવાનગી વોગાર એહેકેન કોઅના મા ઇચ્છા નાંય આતી યાહાટી કા જ્યા ઉપકાર તુમા કોઅતાહા ચ્યા દબાણથી નાંય, બાકી રાજીખુશીથી કોએ.

15 ઓઅય હોકે ઈજ કારણ આતા કા પોરમેહેરાય ઉનેસિમુસાલ વોછા દિહહયાહાટી તો ઇહિને દુઉ નાહાય પોડાહાટી પરવાનગી દેની, કા તો ખ્રિસ્તાવોય બોરહો કોઅય હોકે, એને ચ્યા પાછે તો કાયામ તોઆરે રોય હોકે.

16 તું ચ્યાલ કેવળ તો ગુલામુજ નાંચ હોમાજતો, તો ચોક ગુલામા કોઅતો મોઠો હેય, આમી તો ચોક આર્યો વિસ્વાસી હેય જ્યાવોય તું પ્રેમ કોઇ હોકતોહો, આંચ ચ્યાલ બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી તુલ ચ્યાલ બેની રુપામાય આજુબી વોદારી પ્રેમ કોઅરા જોજે, એટલે તો ગુલામા રુપામાય એને યાહાટી તો ખ્રિસ્તામાય ચોક વિસ્વાસી બાહા હેય.

ફિલેમોના આગના માનનાથી ઉત્સાહિત

17 યાહાટી જો તું માન આપહે મોદાત્યો હોમાજતહો જોવે ઉનેસિમુસ તોપાય પાછો યેય તે ચ્યાલ એહેકેન આવકાર કોઅજે જેહેકેન તું માન આવકાર કોઅહે.

18 એને ચ્યા લેદે જો તુલ કાયબી ખોટાં જાયા ઓરી, યા ચ્યા કર્જા બાકી ઓરી, તે આંચ તી ચુકતાં કોઅય દિહી.

19 આંચ પાઉલ મા આથેકોય લોખતાહાવ, કા આંચ પોતે ચુકતો કોઅય દિહી, તું પેલ્લાથી જાંઅતોહો કા જો આંચ તો મોદાત નાંચ કોઅતો, તે તું પોતે ઈ નોવા જીવન નાંચ મિળવી હોકતો, યાહાટી તું તો પોતે જીવના મા કર્જદાર હેય.

20 મા પ્રિય બાહા, ઓ આનંદ માન ખ્રિસ્ત પ્રભુમાંય તોપાઅને મિળી, ચોક આર્યા વિસ્વાસી રુપામાય એહેકેન કોઇન માન ઉત્સાહિત કોઅય દે.

21 આંચ ઈ પત્ર તુલ યાહાટી લોખી રિઅલો હેય, કાહાકા માન બોરહો હેય કા તું ઈ કોઅહે જી કોઅરાહાટી આંચ તુલ વિનાંતી કોઅય રિઅહો, હાં, માન માલુમ હેય કા તું ચ્યા કોઅતાબી વોદારી કોઅહે, જી આંચ તુલ કોઅરાહાટી વિનાંતી કોઅય રિઅલો હેય.

22 આજુ ચોક વાત: મા રોઅનાહાટી તો ગોઅમે ખોલી તિયારી કોઅજે, કાહાકા માન આશા હેય કા પોરમેહેર તુમહે પ્રાર્થના લીદે માન કૈદમાઅને છોડાવી એને તુમહેપાય પાછો ચીહીં.

છેલ્લી સલામ

²³ ઇપફ્રાસ, જો ઈસુ ખ્રિસ્તા બારામાય પ્રચાર કોચના લીદે મા આરે કૈદી હેય, તો તુમહાન સલામ આપહે.

²⁴ માર્ક, અરિસ્તર્ખુસ, દેમાસ એને લુકા, જ્યા મા આરે ખ્રિસ્તા કામ કોઅતાહા, બોદા તુલ સલામ આખતાહા.

²⁵ આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા તુમા બોદહાઆરે ઓઅતી રોય. આમેન.

ਗਾਮੀਤ ਨੀਵੀਂ ਫ਼ਰਾਤ Bible in Gamit language of India

copyright © 2022 Beyond Translation

Language: (Gamit)

Contributor: Wycliffe USA

Read and download Bible and several other Christian materials in various formats : www.freebiblesindia.in

This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0.

You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:

You include the above copyright and source information.

If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.

If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.

2025-05-02

PDF generated using Haiola and XeLaTeX on 2 May 2025 from source files dated 2 May 2025

4883a606-3c54-5975-b41a-ca7f8faf825d